

## બ્રેમ્પટનમાં પ્રાઇડની ઉજવણી

બ્રેમ્પટન, ઓન્ટારિયો (01 જૂન 2022) – સિટી ઓફ બ્રેમ્પટન જુનને પ્રાઇડ માસ તરીકે સ્વીકારે છે. જીવંત મનોરંજન, સ્થાનિક ફૂડના વિકેતાઓ અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ સાથે સેલિબ્રેટ પ્રાઇડ 2022 ગાર્ડન સ્ક્વેરમાં રવિવાર, જુન 19ના રોજ બપોરે 2 થી સાંજે 7 સુધી રજૂ કરશે TD

બ્રેમ્પટનના વૈવિધ્યપૂર્ણ પચરંગીપણાને વધાવી લેવા માટે સિટી સાથે જોડાઈ જાઓ, સમુદાય સાથે સંબંધ વધારો અને હજુ પણ LGBTTIQQ2SA સમાજ સામનો કરી રહ્યા છે એવી સમસ્યાઓથી વાકેફ થાઓ, ખાસ કરીને એટલા માટે કે તેનો સંબંધ આ વર્ષની થીમ સાથે છે *જસ્ટિસ ઈઝ જોય (ન્યાય આનંદ સ્વરૂપ છે)*

પ્રાઇડ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય અભિયાન છે જે કડ્ડલા અને દયાભાવને વધાવી લે છે. સિટી ઓફ બ્રેમ્પટનને આનંદની લાગણી થાય છે કે વ્યક્તિગત ઇવેન્ટ આ વખતે પાછા થઈ રહ્યા છે જેમાં રજૂ થશે:

- બ્રેમ્પટનના સ્થાનિક કલાકારો અને DJ દ્વારા મંચ પર થનાર લાઇવ કાર્યક્રમો;
- હશીલ x લેડી પિસ્તા અને પ્રખ્યાત પ્રિયંકા દ્વારા મંચ પર થનાર લાઇવ કાર્યક્રમો
- ડ્રેગ સ્ટોરી ટાઇમ અને ફે તથા ફ્લક્કી સાથે મીટ એન્ડ ગ્રીટ;
- સ્થાનિક સમુદાયના સહયોગીઓ તરફથી માહિતી માટેના બૂથ;
- ડાઉનટાઉન બ્રેમ્પટનની સ્થાનિક રેસ્ટોરંટો સાથે ફૂડ માટેનો સહયોગ;
- ઓન-સાઇટ એક્ટિવેશનો અને ગીવઅવેઝ; અને
- લેદી પિસ્તા ભાગ લેશે એવી ૬ રોઝ પેટિયો પર એક આફ્ટર પાર્ટી સાંજે 7 થી 9 વાગ્યા સુધી.

પ્રાઇડ 2022 વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં મુલાકાત લો [brampton.ca/pride](http://brampton.ca/pride).

### સુવાક્યો

"ફરીથી વ્યક્તિગત અને રૂબરૂ પ્રાઇડની ઉજવણી થઈ રહી છે તે જોતા મને અત્યંત રોમાંચ થાય છે. કલાકારો મનોરંજન પીરસવા અને સમાજનું સશક્તિકરણ કરવા અને વધાવી લેવા માટે જબરદસ્ત કાર્યક્રમોની લાઇનઅપ સાથે તૈયાર બેઠેલા છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન એટલે પચરંગી શહેર અને પ્રાઈડ આપણા LGBTTIQQ2SA સમાજને વધાવવા, સમર્થન આપવા અને જાણકારી મેળવવાનો અવસર છે. હું તો બધાને આ વર્ષના જુન 19ના રોજ થનાર આ રૂબરૂ ઉત્સવમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું.

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન આ વૈવિધ્યપૂર્ણ પચરંગીપણાને સમર્થન આપવા અને વધાવી લેવા હંમેશા તત્પર રહ્યું છે. અમારી ટીમ દ્વારા એક સરસ ગમ્મત ભર્યો કાર્યક્રમ ગોઠવ્યો છે અને અમને ફરી આપણા આ રૂબરૂ અને વ્યક્તિગત પ્રાઈડ ઉત્સવમાં બધાને આવકારવાનો આનંદ છે."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)